

November 6, 2020

To,
Listing Compliance Department,
National Stock Exchange of India Limited
Exchange plaza, Plot No.C/1, G Block,
Bandra Kurla Complex (BKC), Bandra (E),
Mumbai-400 051, Maharashtra, IN

Symbol: MACPOWER
Series: EQ

Subject: SUBMISSION OF NEWSPAPER PUBLICATION OF BOARD MEETING NOTICE.

Respected sir/Madam


We would like to inform the exchange that, with reference to Regulation 47 of SEBI (Listing Obligation & Disclosure Requirements) 2015, Kindly find enclosed Newspaper Advertisement regarding Notice of Board Meeting scheduled to be held on Thursday, 12th November, 2020 at 4:00 p.m. at the registered office of the company situated at Plot no.2234, Nr. Krnati Gate, GIDC Metoda, Tal Lodhika Dist. Rajkot-360007, Gujarat, inter alia to consider unaudited financial results for quarter and half year ended on September 30, 2020 published in "The economic times" (English edition) and in "Navgujarat Samay" (Gujarati edition) dated 6th November, 2020.

The above information is also available on company's website i.e. www.macpowercnc.com.

Kindly take the same in your record and oblige.

Thanking you.

For and on behalf of
Macpower CNC Machines Limited


Rupesh Mehta
Managing Director
DIN: 01474523



Personal Finance

THE ECONOMIC TIMES | AHMEDABAD | FRIDAY | 6 NOVEMBER 2020 | WWW.ECONOMICTIMES.COM

ULIP NAVs Here's a ready reckoner to track the week-on-week changes in your ULIP portfolio

Table with columns for Scheme, NAV, % Change, and various insurance and investment schemes.



GROWTH THROUGH GLOBALIZATION, DIVERSIFICATION & INNOVATION. Standalone and Consolidated performance metrics.

Extract of the Un-audited Financial Results (Standalone & Consolidated) for the Quarter and Half Year ended on September 30, 2020. Includes tables for Standalone and Consolidated results.

Notes: a. The above results were reviewed by the Audit Committee... b. The above is an extract of the detailed format of the Financial Results...

For, SADBHAV ENGINEERING LIMITED. Place: Ahmedabad. Date: November 05, 2020.

For, MACPOWER CNC MACHINES LIMITED. Place: Rajkot. Date: 05-11-2020.

NOTICE: Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015...

NOTICE: Notice is hereby given that the following share Certificates of HLL Glass Limited...

NOTICE OF LOSS OF SHARES OF RELIANCE INDUSTRIES LTD. MAKER CHAMBERS, 4, 3rd FLOOR, 222, NARIMAN POINT, MUMBAI - 400021

NOTICE: Notice is hereby given that the following share Certificates of HLL Glass Limited...

NOTICE OF LOSS OF SHARES OF RELIANCE INDUSTRIES LTD. MAKER CHAMBERS, 4, 3rd FLOOR, 222, NARIMAN POINT, MUMBAI - 400021

NOTICE: Notice is hereby given that the following share Certificates of HLL Glass Limited...

NOTICE OF LOSS OF SHARES OF RELIANCE INDUSTRIES LTD. MAKER CHAMBERS, 4, 3rd FLOOR, 222, NARIMAN POINT, MUMBAI - 400021

NOTICE: Notice is hereby given that the following share Certificates of HLL Glass Limited...

NOTICE OF LOSS OF SHARES OF RELIANCE INDUSTRIES LTD. MAKER CHAMBERS, 4, 3rd FLOOR, 222, NARIMAN POINT, MUMBAI - 400021

સીએએ મુદ્દે યોગીએ કહ્યું, ઘૂસાણાખોરને બહાર કાઢશું, નીતિશે કહ્યું, કાઠી મૂકવાની વાતો ફાલતુ છે નીતિશનું VRS ? અંતિમ પ્રચાર સભામાં આ પોતાની છેલ્લી ચૂંટણી હોવાનું એલાન

એવજ્ઞી > પટણા

■ બિહાર વિધાન ચૂંટણી જંગનો પ્રચાર ગુરુવારે સમાપન થવાના ગણતરીના કલાકો પૂર્વે મુખ્યમંત્રી નીતિશ કુમારે કેપ્ટન કાર્ડ ઉત્તરવાનો અંતિમ દાવ અજમાવ્યો હતો. 69 વર્ષીય નીતિશ કુમારે પૂર્વિયા જિલ્લાના ધમદાહામાં જેડીયુની રેલીમાં કહ્યું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. તેમણે જેડીયુના ઉમેદવાર લેસી સિંહના પ્રચાર માટે સભાને સંબોધી હતી. નીતિશ કુમારે જનસભામાં વધુમાં કહ્યું કે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સખ ભલા. કહી લેસી સિંહને જીતાડશોને. પંજાબમાં ચૂંટણી દરમિયાન જેડીયુના કેપ્ટન અમરિન્દર સિંહે પણ પોતાની આ અંતિમ ચૂંટણી હોવાનું એલાન કરીને બાદલ સરકારને પછડાટ



આપવામાં સફળતા મેળવી હતી. બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતિશ કુમાર સીએએના અમલ મુદ્દે સામસામે આવી ગયા હતા. એક સભામાં યોગી આદિત્યનાથે ઘૂસાણાખોરને દેશની બહાર તગેડી મુકવાની ગર્જના કરી હતી. તેમણે કહ્યું કે આજે આપણે જીતવાનું નથી, જીતવાનું નથી, જીતવાનું નથી. આજે આપણે જીતવાનું નથી, જીતવાનું નથી, જીતવાનું નથી. આજે આપણે જીતવાનું નથી, જીતવાનું નથી, જીતવાનું નથી.

અમારે હિસાબ કોની પાસેથી લેવાનો ? ચિરાગ

બિહારમાં 7મી નવેમ્બરે અંતિમ તબક્કાના મતદાન પૂર્વે મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની જનતાને ભાવુક અપીલ કરતા આ પોતાની અંતિમ ચૂંટણી હોવાનું કહી સ્વેચ્છિક નિવૃત્તીની જાહેરાત કરી દીધી હતી. નીતિશ કુમારના આ નવા દાવ પર લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને અને આરપેડીના નેતા તેજસ્વી યાદવે સીધો પ્રહાર કર્યો હતો. તેજસ્વીએ કહ્યું કે અમે પહેલાંથી કહેતા આવી રહ્યા હતા કે તેઓ હવે સંપૂર્ણપણે થાકી ગયા છે અને આજે આખરે તેમણે અંતિમ ચરણના મતદાન પૂર્વે હાર માની લઈને રાજનીતિમાંથી સંસ્થાને લેવાનો જાહેરાત કરી દીધી છે. તે એલજેપીના ચિરાગ પાસવાને કટાક્ષ કરતા કહ્યું કે રણભૂમિ પરથી નેતા જ રથ છોડીને ભાગી જાય તો બાકીના લોકો શું કરશે? આ વખતે છેલ્લા 6 વર્ષનો હિસાબ તો આપ્યો નહીં અને અલ્પવાચી કહી દીધું કે આગામી વખતે હિસાબ દેવા આવશે નહીં. આગામી ચૂંટણીમાં ના સાહેબ રહેશે ના જેડીયુ તો પછી લોકો હિસાબ કોની પાસેથી માગશે?

કોઈનામાં એટલો દમ નથી કે તે આપણા લોકોને દેશમાંથી બહાર કાઢી મૂકે. આ બંધી ફાલતુ વાતો છે. કિશનગંજમાં મુખ્યમંત્રીએ અલ્પસંખ્યકોના કલ્યાણ અને તેમની માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. તેમનો ઈશારો નાગરિક સંશોધન કાયદા તરફ હતો. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે બધાને સાથે વધુ જ અમારો ધર્મ છે. આ જ આપણી સંસ્કૃતિ છે. બધા સાથે ચાલવું તો બિહાર આગળ વધશે.



અમિત શાહના મેનુમાં ગંગાળ...

હજુ તો બિહાર વિધાનસભા ચૂંટણીના આખરી તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયાં છે ત્યાં ભાજપે ગંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારની આકમક ટેવણી આરંભી પણ દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગંગાળના બે દિવસના પ્રવાસે છે જ્યાં તેમણે વધારામાં ગંગાળ હવે કે ગંગાળના તમામ વર્ગના લોકો હવે દીઠાના શાસનથી છૂટકારો માગે છે. અમિત શાહે એક આદિવાસી કાર્યકરને ત્યાં ગંગાળી ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ: મારે નીતિશની જરૂર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારવાસીઓને પત્ર પાઠવ્યો

એવજ્ઞી > નવી દિલ્હી

■ બિહારમાં અંતિમ તબક્કાના મતદાનના કાઉન્ટ-ડાઉન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારવાસીઓને એક પત્ર પાઠવ્યો છે. વડાપ્રધાન મોદીએ રાજ્યની જનતાને અપીલ કરતા પત્રમાં જણાવ્યું હતું કે મને રાજ્યમાં સુશાસન માટે નીતિશની સરકારની જરૂર છે. જેથી બિહારમાં વિકાસની યાત્રા ઠપ ન થઈ જાય. બહુ અનિચ્છની શક્તિ આગામી દાયકામાં રાજ્યને વિકાસની નવી ટોચ પર લઈ જશે. વડાપ્રધાને પોતાના ચાર પેઢાના પત્રમાં પ્રથમ બે તબક્કામાં મોટીસંખ્યામાં મતદાન કરવા માટે રાજ્યના લોકોને અભિનંદન આપ્યા છે. વોટનંત્રના મહાપર્વમાં બિહારના મતદારોનો જોશ તેમને હજુ વધુ ઉત્સાહથી



કામ કરવા માટે પ્રેરણા પુરી પાડી રહ્યો છે. વડાપ્રધાને એનડીએ સરકારે છેલ્લા વર્ષોમાં જે વિકાસ કામો કર્યાં, તેનું રિપોર્ટ કાર્ડ જ નહીં. આગામી સમયગાળામાં ક્યા કામો થશે. તે વિશે પણ જણાવ્યું હતું. રાજ્યમાં મજબૂત પાયા માટે વિકાસ અને કાયદાનું રાજ એનડીએ સરકાર જ કરે છે. અવ્યવસ્થા અને અરાજકતાના માહોલમાં નવનિર્માણ શક્ય નથી. વર્ષ 2005 પછી બિહારમાં માહોલ બદલાવ્યો અને નવનિર્માણનો સુપ્રોંઠય થયો છે.

અરજીની સુનાવણીમાં ફરિયાદકર્તા જરૂરી પક્ષકાર છે: જસ્ટીસ શિંદે

અર્નબ ગોસ્વામીનો જેલ યોગ યથાવત, બોમ્બે હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી

એવજ્ઞી > મુંબઈ

■ અર્નબ ગોસ્વામીને આપઘાત માટે દુષ્કરણા કેસમાં વચગાળાના જામીન માટેની અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં વધુ સુનાવણી શુક્રવારે બપોરે ૩ કલાકે હાથ ધરાશે. હાઈકોર્ટે ગુરુવારે એ સ્પષ્ટ કર્યું હતું કે કાલે અર્નબ ગોસ્વામીની વચગાળાની રાહત પર સુનાવણી થશે. અર્નબની બુધવારે ધરપકડ બાદ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરાયો હતો. બાદમાં અર્નબને વચગાળાના જામીનની માંગ કરી હતી. અર્નબના વકીલ આબાદ પોંડાએ કહ્યું, એક નાગરિકને ગેરકાયદેસર રીતે



અટકમાં લેવામાં આવ્યા છે. પોલીસની ફરીથી કરેલી તપાસમાં બખર પંડે છે કે મેજિસ્ટ્રેટ માટે અસમાન દર્શાવવામાં આવ્યું છે. પોલીસે કેસને રિ-ઓપન કરવા માટે 15મી ઓક્ટોબર, 2020ના મેજિસ્ટ્રેટને ફક્ત સૂચના આપી. કોર્ટે તેમને મંજૂરી આપી નથી. આ માટે આગળની તપાસ માટેના કોર્ટ સંકેત આપ્યા નથી. પોંડાએ કહ્યું કે પ્રશ્ન છે કે, “એ” સમરી આજે પણ જળવાયેલી છે કે નહીં. જો આ જળવાયેલી છે, તો કેસ ‘મુત’ છે. પોલીસ આંગે ફરી જીવિત નથી આવ્યો છે. આંગે જસ્ટિસ શિંદેએ કહ્યું કે મૂળ ફરિયાદકર્તાની અરજી આજે પણ સુધિબદ્ધ છે. તેના પર પણ સુનાવણીની જરૂર છે. અર્નબના વકીલે કહ્યું કે અલીબાગ મેજિસ્ટ્રેટ હજુ જામીન અરજી માટે તારીખ આપી નથી. માટે અમે ગુરુવારે બપોરે ૩ કલાકે અમારી જામીન અરજી પાછી લઈ લીધી છે. ન્યાયિક આદેશ વગર, આગળની તપાસ થઈ શકે નહીં. માટે રાયગઢ પોલીસની ધરપકડ ગેરકાયદેસર છે. જસ્ટિસ શિંદેએ મામલામાં કહ્યું કે

અરજી માટે ફરિયાદકર્તા એક જરૂરી પાર્ટી છે, પણ તમારી અરજીમાં તેને પાર્ટી બનાવવામાં આવી નથી. આ પર પોંડાએ કહ્યું કે, “હું મર્યાદિત રાહત માટે આવ્યો છું. મારી અરજી માત્ર પોલીસ વિરુદ્ધ છે ન કે ફરિયાદકર્તા (નાઈક પરિવાર)ની સામે. હરીશ સાલ્વેએ કહ્યું કે “અમને યાચિકામાં સંશોધન કરવા અને ફરિયાદકર્તાને કેસમાં જોડવાની તક આપો. અમને મૌખિક અવકાશ આપો. ફરિયાદકર્તા અહીં છે. તે પોતે પણ સાંભળી શકે છે.” ત્યારબાદ હાઈકોર્ટે યાચિકામાં ફરિયાદકર્તાને પક્ષકાર બનાવવા માટે સંશોધનની પરવાનગી આપી અને કેસની સુનાવણી શુક્રવાર માટે ટાળી દીધી છે.

ભાજપ કાર્યકરની હત્યાના પડચંત્રમાં કર્ણાટકના માજી મંત્રીની ધરપકડ

CBએ કોંગ્રેસના વિનય કુલકર્ણીની પૂછપરછ બાદ ધરપકડ કરી

એવજ્ઞી > બેંગ્લુરુ

કાવતરની વધુ વિગતો મેળવવા તેમમને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી જરૂરી હોવાથી ધરપકડ કરવામાં આવી હોવાનું સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું. કુલકર્ણી 2013માં ધારવાડ સીબીઆઈએ રાજ્યના માજી મંત્રી વિધાનસભા બેઠક પરથી જીત્યા વિનય કુલકર્ણીની ધરપકડ કરી હતી. પરંતુ, 2018માં તેમની ભાજપના અમૂત અયપ્પા દેસાઈ સામે હાથ ધર્યો હતો. ભાજપના ધારાસભ્ય અને રાજ્યમાં ખાણપતિજ પાતંત્રો હતાવો ધરાવતા કુલકર્ણી 2016ની 15મી જુને એક જીમમાં ગોવડાની હતાવું કાવતરું ધરાવતાં અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. સામેલ હોવાનું સીબીઆઈને જણાવ્યું છે. સીબીઆઈએ દિવસભર તેમની પૂછપરછ કરી હતી. તેમાં તેઓ જણાવ્યું હતું, જોકે, રાજ્ય સરકારે આ ઊડાણ જવાબો આપી રહ્યા હોવાથી તપાસ સીબીઆઈને સોંપી હતી.



ભારત બાયોટેકની કોરોનાની 'કોવેક્સીન' ફેબ્રુઆરી સુધી લોન્ચ થશે

એવજ્ઞી > નવી દિલ્હી

■ કોરોના વાયરસની સંભવિત રસી 'કોવેક્સીન'ના નિર્માણ ભારત બાયોટેક અને ઈન્ડિયન કોર્પોરેશન ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર) મળીને કરી રહ્યા છે. ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સીન સમય કસ્ટમાં પહેલાં લોન્ચ કરવાની શક્યતા છે. આઈસીએમઆરના કહેવા અનુસાર આ વેક્સીનને ફેબ્રુઆરીના શરૂઆતમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે. વેક્સીનના અંતિમ ચરણના ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાના શરુમાં થયો છે, હમણાં સુધીના સ્ટડીથી આ વેક્સીન સુરક્ષિત અને અસરકારક છે. કોરોના વાયરસ વેક્સીનની જાણકારી આપતાં આઈસીએમઆરે કહ્યું કે આગામી વર્ષ 2021ના આરંભના મહિનાઓમાં આ વેક્સીન લોન્ચ કરવામાં વે તેવી આશા છે. આઈસીએમઆરના પ્લાનિંગ કો-ઓર્ડિનેટર ડો. રજનીકાંતે જણાવ્યું કે રસી ખૂબ અસરકારક દેખાઈ રહી છે. આશા છે કે આગામી વર્ષ ફેબ્રુઆરી-માર્ચ સુધી રસી લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે. જો વેક્સીન ફેબ્રુઆરીમાં લોકો માટે ઉપલબ્ધ થઈ જાય છે તો ભારત નિર્મિત દેશની પહેલી કોરોના વેક્સીન હશે. કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય રજનીકાંતે કહ્યું કે વેક્સીન પહેલા અને બીજા ચરણના પરીક્ષણમાં પ્રાણીઓના અધ્યયનમાં સુરક્ષા અને અસરકારકતા દેખાઈ છે.

રાજસ્થાન, ગંગાળ, ઓરિસ્સા પછી વધુ એક રાજ્યમાં પ્રતિબંધ દિલ્હીમાં પણ તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો

એવજ્ઞી > નવી દિલ્હી

■ દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના વાયરસનો ફરીથી ફેંકાડો અને પ્રદૂષણ વધતા રાજધાનીમાં કોઈપણ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પહેલાં શ્રીન કટાકડાને વેચવાની છૂટ અપાઈ હતી. હવે તેના પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. રાજ્યમાં ફટાકડાનું ખરીદ-વેચાણની સાથે ફોડી શકારો પણ નહીં. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રાતોરાત વધતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે

ગુરુવારે મુખ્ય સચિવ, આરોગ્ય સહિત અન્ય વિભાગો ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે બેઠક બાદ ટવીટ કરીને તહેવારોની મોસમ અને પ્રદૂષણનું સ્તર મહાનગરમાં વધતા દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અેથી દિલ્હી સરકારને 5 મુખ્ય પગલાં લીધાં છે. જેમાં તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ, દિલ્હી સરકારની ઓફિસલોમાં ઓક્સીજન અને આઈસીએમઆરની સંખ્યા વધારવી અને મેડિકલ સુવિધાઓ વધારે શ્રેષ્ઠ બનાવવાનું સામેલ છે.

ફટાકડા પ્રતિબંધ ના લાદવા તમિલનાડુ સીએમની અપીલ
તમિલનાડુના સીએમ પાલનિરાવનીએ જુદાં જુદાં રાજ્યોને ફટાકડા પર પ્રતિબંધ પર ફેરવિયારણા માટે અરજી કરી છે. તેમણે આ રાજ્યોના મુખ્યપ્રધાનોને અપીલ કરતાં કહ્યું હતું કે તમિલનાડુના આઠ લોકો લોકો ફટાકડા મેચ્યુરેકેશનમાં રોજગારી મેળવે છે. ફટાકડા પર પ્રતિબંધથી તેમની રોજગારી પર બહુ મોટું ખોમ સર્જશે.

દિવાળીના તહેવારોમાં ટ્રાફિક વધવાની આશા પ્રવાસીઓ વધતાં 75% ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ચાલુ કરી દેવાશે

એવજ્ઞી > નવી દિલ્હી

■ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થવાની સાથે ડોમેસ્ટિક ફ્લાઈટની સંખ્યાની મર્યાદા કોરોના પહેલાં હતી તેના 70થી 75 ટકા જેટલી કરી દેવામાં આવશે એમ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાણવાયું છે. મંત્રાલયે ગયાં સપ્તાહે જણાવ્યું હતું કે સ્થાનિક વિમાની કંપનીઓ આગામી તા. 24મી ફેબ્રુઆરી સુધીમાં તેમની કોવિડ પહેલાંની ડોમેસ્ટિક

મંત્રાલયે ગયા સપ્ટેમ્બર માસની બીજી તારીખે વિમાન કંપનીઓને ફ્લાઈટની સંખ્યા મહત્તમ 60 ટકા રાખવા જણાવ્યું હતું. દેશમાં બે મહિના માટે ડોમેસ્ટિક ફ્લાઈટ બંધ કરાયા બાદ ગઈ તા. પચ્ચીસમી મે થી તેનો પુનઃ પ્રારંભ કરાવાયો હતો. એરલાઇન્સને આશા છે કે સરકાર બહુ જલ્દી કોરોના પહેલાં ડોમેસ્ટિક ફ્લાઈટને 70 ટકા જેટલો સ્તરે ચલાવવા માટે મંજૂરી આપી દેશે. દેશમાં જોડે શિશુલુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ હજુ પણ પ્રતિબંધિત છે.

ઈન્ડોનેશિયામાં જવાબામુખી ફાટ ફાટ થતાં પ્રવાસન સહિતની પ્રવૃત્તિઓ બંધ

એવજ્ઞી > યોગ્યકર્તા

■ કર્ણાટકના ધારવાડ જિલ્લામાં 2016ઈન્ડોનેશિયામાં માઈન્ટ મેરાળી જવાબામુખીની જાચ ટાપુઓ પર ડેન્જર લેવલ વધાર્યું છે અને પ્રવાસન તથા માઈનિંગ સહિતની પ્રવૃત્તિઓ બંધ કરી દેવા આદેશ આપ્યા છે. મેરાળી ગયાં વર્ષથી સક્રિય થયો છે. તેની સક્રિયતા વધતાં ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીએ તેનું એલર્ટ લેવલ ત્રીજી સૌથી સર્વોચ્ચ સ્પાટીથી વધારીને બીજી સર્વોચ્ચ સ્પાટીએ કરી દીધું છે. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા રાહિયા જિતિએ કહ્યું હતું કે આ સ્તરની સક્રિયતાને કારણે

જવાબામુખી ફાટ અથવા તો લાવા બહાર નીકળે તેવી સંભાવના સર્જાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ મેરાળી પર પર્યટન ચઢાણ તથા તેની નદીઓ આસપાસ માઈનિંગ પ્રવૃત્તિઓ અટકાવી દીધી છે. માત્ર ડિઝાસ્ટર એજન્સીના કર્મચારીઓ તથા સંશોધકોને જ પ્રતિબંધિત વિસ્તારમાં જવાની છૂટ મળશે. મેરાળીએ ગયા જુન માસમાં ડિલોમીટર ઊંચે સુધીની રાખ અને ગરમ ગેસનો ફુવારો છોડ્યો હતો. જોકે, તેમાં કોઈ ખુવારી થઈ ન હતી. 2010માં આ જવાબામુખી ફાટમાં 347 લોકો માર્યા ગયા હતા અને 20 હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. 9737 ફૂટની ઊંચાઈ ધરાવતો આ જવાબામુખી પર્વત યોગ્યકર્તા શહેરથી 30 કિમીના અંતરે છે.

બે વર્ષ સોશિયલ મીડિયાથી દૂર રહેવાની શરતે જામીન

એવજ્ઞી > અલ્હાબાદ

■ અલ્હાબાદ: અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે ઓનલાઇન એક વાંધાજનક ટિપ્પણી કરનારા આરોપીને એ શરતે જામીન આપ્યા હતા કે તેણે બે વર્ષ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે. દેવરિયાના અખિલાનંદે યોગી ઉપરાંત અન્ય મહાનુભવો માટે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેણે કરેલી જામીન અરજીને મંજૂર કરતી વખતે જસ્ટિસ સિદ્ધાર્થે આ હુકમ કર્યો હતો. અખિલાનંદે ગઈ તા. 12મી મેથી જેલમાં છે.

Change of Name (Name Bifurcation) I, Conchita residing at H.No: 380/5, om nagar, near hospital, Diu, solemnly declare that my Given Name(s) is: Conchita Maryjesus Mercas and Surname is: De Almeida. CHANGE OF NAME I THE UNDERSIGNED ZALAVADIA MAYUR RAMNIKLAL HERE BY DECLARE THAT, I HAVE CHANGED MY OLD NAME ZALAVADIA MAYURBHAI RAMNIKLAL TO ZALAVADIA MAYUR RAMNIKLAL AND NOW FORWARD, I WILL BE KNOWN AS MY NEW NAME ZALAVADIA MAYUR RAMNIKLAL SD : ZALAVADIA MAYUR RAMNIKLAL RAJKOT DT.06-11-2020

MACPOWER CNC MACHINES LIMITED [Corporate Identity Number (CIN): L30009GJ2003PLC043419] Reg. Office : Plot No. 2234, Near Kanti Gate, GIDC Metoda-360 021, Talu-Lodhika, Dist-Rajkot, Gujarat, India. Mo : 72111 44413 Email : csm@macpowercnc.com Website : www.macpowercnc.com NOTICE Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI(Listing Obligations and Disclosures Requirement) Regulations, 2015 (LODR), Notice is hereby given that a meeting of Board of directors of the Company will be held on Thursday, 12th day of November, 2020 at 4:00 p.m. at the Registered office of the company situated at Plot No. 2234, Near Kanti Gate, GIDC Metoda-360 021, Talu-Lodhika, Dist-Rajkot, Gujarat, Inter alia to consider and approve, the un-audited Financial results (Standalone) for the quarter and half year ended 30th September,2020. This information is also available on the website of the company at www.macpowercnc.com and on the website of stock exchanges at www.nseindia.com. For, Macpower CNC Machines Limited Sd/- RUPESH J. MEHTA Chairman & Managing Director DIN: 01474523 Place : Rajkot Date : 05-11-2020

ખંડ નં.	ઈ-કોડ નં.	કામનું નામ	મંડળીત બેંક/ફાઇનાન્સીયલ ઇન્સ્ટિટ્યુશન	ઈએમ્પી (₹)
01	DRM-ADI-174-2020-21	દિવિન્યાસ એનિનિયર (પરિ.) બંધનકામ	₹ 1,42,37,088.99	₹ 2,21,200.00
02	DRM-ADI-175-2020-21	ગોધીવન-ન્યુ બુટ સેલમ : 01 (એક) નવ રોડ અંતરજિજા ઉપરથય	₹ 2,14,22,278.42	₹ 2,57,100.00
03	DRM-ADI-176-2020-21	ગોધીવન-ન્યુ બુટ સેલમ : 01 (એક) નવ રોડ અંતરજિજા ઉપરથય	₹ 2,13,77,033.16	₹ 2,56,900.00
04	DRM-ADI-177-2020-21	વિરમગામ - સામીબધવી સેલમ : 01	₹ 1,20,05,982.59	₹ 2,10,000.00
05	DRM-ADI-178-2020-21	વિરમગામ - સામીબધવી સેલમ : 01	₹ 46,17,055.56	₹ 92,400.00
06	DRM-ADI-179-2020-21	વિરમગામ - સામીબધવી સેલમ : 01	₹ 1,58,71,102.02	₹ 2,29,400.00

ફેરફાર કોરોનાને કારણે ભારતનું કોસ્મેટિક બજાર બદલાઈ ગયું આઈ લાઈનરમાં તેજ, લિપસ્ટિકને ફટકો

એવજ્ઞી > નવી દિલ્હી

■ વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકોની રોજિંદી જિંદગીમાં કેટલાય ફેરફાર આવી ગયા છે. માસ્કના રોજિંદા જીવનમાં એક અનિવાર્ય હિસ્સો બનાવેલી કોવિડ-19 મહામારીએ મેકઅપની દુનિયાને બિલકુલ બદલી નાખી છે. અનુમાન અનુસાર, હોલ સતત ફેસ માસ્કની પાછળ રહેવાના કારણે લિપસ્ટિકના વેચાણ પાછળ ગત વર્ષની તુલનામાં 70 ટકા ઘટી ગયું છે. જ્યારે અન્ય કોસ્મેટિક ઉત્પાદનો, ખાસ કરીને આઈ-મેકઅપની ખરીદી વધી છે.



આ એક એવો બદલાવ છે જે બજાર વિશ્લેષકોએ પહેલીવાર જોયો છે. નાણાકીય સેવા કંપની એડલવાઈસના વિશ્લેષક નિહાલ મહેશા જામે કહ્યું કે, કોવિડ-19ના કારણે લાગુ પ્રતિબંધોથી ભારતીય ગ્રાહકોની અવરજવર પર પડેલી અસરના કારણે લિપસ્ટિકનો રોજનો ઉપયોગ ખૂબ ઘટી ગયો છે. કુલ મળીને લિપસ્ટિક શ્રેણીના વેચાણમાં ગત વર્ષની તુલનામાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે. કોસ્મેટિક વેચનારી કંપનીઓના કહેવા અનુસાર, લિપસ્ટિકની વિવિધ શ્રેણીની ઈસ્ટિએ પણ ફેરફાર નજરે પડી રહ્યો છે. તેમના કહેવા અનુસાર લિપસ્ટિક ખરીદ પણ રહ્યાં છે એ પણ ગ્લોસીની તુલનામાં હવે સ્મજ અને ટ્રાન્સફર પ્રૂફ મેટ વેરિએન્ટને મહત્વ આપી રહ્યાં છે. 19000થી વધુ બ્યૂટી બ્રાન્ડ વેચનારી ડિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન ઈન્ડિયામાં બ્યૂટી, યુબિંગ અને લક્ઝરી બ્યૂટી પ્રમુખ મુશ્કામ મહેતાએ કહ્યું કે, મેકઅપ બજારમાં સૌથી વધુ ભાગીદારી વાળી લિપ કેટેગરીના વેચાણમાં કોવિડ-19 પૂર્વના સમયની સ્થિતિમાં ઘટાડાવાની દિશામાં ગતિ ખૂબ ધીમી છે. ટુંકમાં, હજુ કોસ્મેટિક ઉદ્યોગને બેઠાં થવામાં વાર લાગી શકે છે.

બેસણું અમારા પિતાશ્રી સ્વ. અશોકભાઈ રમણલાલ ઠાકર તા. ૦૨-૧૧-૨૦૨૦ ને સોમવારને રોજ સ્વર્ગવાસ પામેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સંઘનું બેસણું : તા. ૦૮-૧૧-૨૦૨૦ને રવિવાર સમય : સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાકે સ્થળ : હરેશ્વર મહાદેવ, આસાપુરી માતા ચોક, કઠલાલ પ્રશાંત અશોકભાઈ ઠાકર પ્રિતેશ અશોકભાઈ ઠાકર મો. ૮૭૮૦૧ ૧૫૬૬૪ મો. ૮૫૧૧૧ ૦૮૧૦૮ વ્રજ પ્રશાંતભાઈ ઠાકર સમસ્ત ઠાકર પરિવાર - કઠલાલ, જિ. ખેડા

ઓકલાવ નગરપાલિકા ઓકલાવ ઓકલાવ નગરપાલિકા ODF++ તરીકે નગરપાલિકા જાહેર કરવા જોગ પ્રવૃત્તિ/મુદત/સુધારો/સુધારો મંગાવવા બાબત ઓકલાવ નગરપાલિકા જાહેર જનતાને અહીં સુધી કરવામાં આવે છે કે, ઓકલાવ નગરપાલિકા દ્વારા ODF++ જા